

॥ શ્રી શિક્ષાપત્રી ॥

<http://www.swaminarayan.nu/>

શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્તસંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકી પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે - હું જે તે મારા હદ્યને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિષે ચાહિકજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. ॥ ૧ ॥

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા જે સહજાનંદ સ્વામી, જે અમે તે અમ, જે તે નાના પ્રકારના જે સર્વ દેશ, તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વ સત્તસંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખાયે છીયે. ॥ ૨ ॥

શ્રી ધર્મદીવ થકી છે જીનું જેમનો, એવા જે અમારા ભાઈ ચામપ્રતાપજી તથા ઈચ્છારામજી, તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે, (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વ સત્તસંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છ) ॥ ૩ ॥

તથા અમારા આશ્રિત એવા જે મુકુદાનંદ આદિક નૈષિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મધ્યારામ ભરૂ આદિક ગૃહસ્થ સત્તસંગી ॥ ૪ ॥

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વ ભાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વ સાધુ ॥ ૫ ॥

એ સર્વ તેમણે પોતાના ધર્મની રક્ષા કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમત્રારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશ્રોવાંદ તે વાંચવા. ॥ ૬ ॥

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કરણ છે, તે સર્વ તેમણે એકાગ્ર મને કરીને ધારવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે, તે સર્વના જીવન હિતની કરનારી છે. ॥ ૭ ॥

અને શ્રીમદ્ ભાગવતપુરાણ આદિક જે સત્તસાસ્ત્ર, તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે આહિસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પળે છે, તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે ભધા સુભિયા થાય છે. ॥ ૮ ॥

અને તે સદાચારનું ઉત્ત્વલંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્ત્ત છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આ લોક ને પરલોકને વિષે નિશ્ચ મોટા કાષ્ટને જ પામે છે. || ૮ ||

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વ તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉત્ત્વલંઘન કરીને વર્તવું નહિ. || ૧૦ ||

હવે તે વર્ત્યાની રીત કહીયે છીઅ જે, અમારા જે સત્તસંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિસા ન કરવી અને જાણીને તો જીણા એવા જૂં માંકડ, ચાંચડ આદિક જીવ, તેમની પણ હિસા ક્યારેય ન કરવી. || ૧૧ ||

અને દેવતા અને પિતૃ તેના યજને અર્થી પણ બકરા, મૂગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિસા ન કરવી, કેમ જે અહિસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કલ્યો છે. || ૧૨ ||

અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થી પણ કોઈ મનુષ્યની હિસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. || ૧૩ ||

અને આત્મધાત તો તીર્થને વિષે પણ ન કરવો, અને ક્ષેત્રે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુંજાઈને પણ આત્મધાત ન કરવો અને તેર ખાઈને તથા ફૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મધાત ન કરવો. || ૧૪ ||

અને જે માંસ છે તે તો યજનું શેષ હોય તોપણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તોપણ ન પીવું. || ૧૫ ||

અને ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય, તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્ષેત્રે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. || ૧૬ ||

અને ધર્મ કરવાને અર્થી પણ અમારા સત્તસંગી કોઈએ ચોરનું કર્મ ન કરવ, અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. || ૧૭ ||

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યાખ્યાર ન કરવો અને જૂગઢું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ. || ૧૮ ||

અને જેના ધારનું રંધેલ અજ તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રંધેલ અજ તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણમૂત્રના માહાત્મ્યે કરીને જગત્તાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગત્તાથપુરીને વિષે જગત્તાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. || ૧૬ ||

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે ભિષ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. || ૨૦ ||

અને દેવતા, તીથ, બ્રાહ્મણ, પતિત્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. || ૨૧ ||

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. || ૨૨ ||

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંહિર આવે, તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. || ૨૩ ||

અને પોતપોતાના વર્ણશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્યિપત ધર્મનું આચરણ ન કરવું. || ૨૪ ||

અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખથકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. || ૨૫ ||

અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતાંગી હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષ કોઈની લાંચ ન દેવી. || ૨૬ ||

અને ચોર, પાપી, વસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક છિયાને કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. || ૨૭ ||

અને જે મનુષ્ય ભક્તિનું અથવા શાનનું આલંબન કરીન સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થક પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યાનો સમાગમ ન કરવો. || ૨૮ ||

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવાં.

॥ ૨૮ ॥

અને ગાય્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ગીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક કિયા ન કરવો. ॥ ૩૦ ॥

અને જે ઔષધ, દારુ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્ય ના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. ॥ ૩૧ ॥

અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજ્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આચાર તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા, ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહિ. ॥ ૩૨ ॥

અને ચોરમાર્ગ કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્થાનક ધણિયાં હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ॥ ૩૩ ॥

અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજી સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ॥ ૩૪ ॥

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્ધાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. ॥ ૩૫ ॥

અને વિચાર્યા વિના તત્કાળ કંઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા બણ્યા હોઈએ તે બીજાને બણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ॥ ૩૬ ॥

અને ગુરુ, દેવ અને રાજા એ વ્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઢાલે હથે ન જવું અને કોઈનો વિશ્વાસધાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ॥ ૩૭ ॥

અને જે વસ્ત્ર પહેર્ય થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંકું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ॥ ૩૮ ॥

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મ રહિત એવી કાઈ પ્રકારે ન કરવો અને અજ્ઞાની એવા જે મનુષ્ય, તેમની નિંદાના ભયથકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. || ૩૬ ||

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્તસંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. || ૪૦ ||

અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વैશ્ય - એ ત્રણ વર્ડાના અમારા સત્તસંગી તેમણે કંઠને વિષે તુળસીની બેવડી માળા નિત્યે ધારવી, ને લલાટ, હદ્ય અને બે હાથ - એ ચારે ડેકાણો ઊર્ધ્વપુંડ તિલક કરવું. || ૪૧ ||

અને તે તિલક જે તે ગોપીયંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન, તેણે કરીને તિલક કરવું. || ૪૨ ||

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો, તે જે તે ગોપીયંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ, તેણે કરીને તે ચાંદલો કરવો. || ૪૩ ||

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છૂદ્ર, તેમણે તો તુળસીની માળા અને ઊર્ધ્વપુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વैશ્યની પેઢે ધારવાં. || ૪૪ ||

અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉત્તરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાણની બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો પણ તિલક ન કરવું. || ૪૫ ||

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આદું તિલક કરવું તથા દુદ્રાક્ષની માળા ધારવી, એ બે વાનાં પોતાની કુણપરંપરાએ કરી ચાલ્યાં આવ્યાં હોય, અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તોપણ તેમણે ત્રિપુંડ અને દુદ્રાક્ષનો કચારેય ત્યાગ ન કરવો. || ૪૬ ||

અને નારાયણ અને શિવજી, એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેયનું પ્રલુદ્યે કરીને પ્રતિપાદન કર્યું છે. || ૪૭ ||

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કલ્યો જે આપર્દ્ધર્મ, તે અલ્ય આપત્કણને વિષે મુખ્યપણે કરીને કચારેય ગ્રહણ ન કરવો. || ૪૮ ||

અને અમારા સત્તસંગી તેમણે નિત્ય સૂર્ય ઊઝાથી પ્રથમ જ જાગવું, અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. || ૪૮ ||

અને પછી એક સ્થાનકને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળો કરીને સ્નાન કરીને, પછી ધોયેલું વસ્ત્ર ઓક પહેરવું અને એક ઓઢવું. || ૫૦ ||

અને તે વાર પછી, પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ અને કોઈ બીજા આસનને અડવું ન હોય અને જ ઊપર સારી પેઠે બેસાય, એવું જે આસન તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચયમન કરવું. || ૫૧ ||

અને પછી સત્તસંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાવને વિષે કુંકુમનો ચાંદલો કરવો. || ૫૨ ||

અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાવને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો, અને તે પછી તે સર્વે જે અમારા સત્તસંગી તેમણે મને કરીને કલ્યા જે ચંદન, પુષ્પાદિક ઉપયાર, તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. || ૫૩ ||

અને તે પછી શ્રીરાધાકૃષ્ણાની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અભ્યાક્ષર મંત્ર તેનો જપ કરીને, તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. || ૫૪ ||

અને જે અમારા સત્તસંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કલ્યાં તેવી રીતે અનુકૂળે કરીન માનસી પૂજા પર્યત સર્વે છિયા કરવી. || ૫૫ ||

અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાખણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ, તેની જે પૂજા તે દેશક્ષળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે ગ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ, તેણે કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો અભ્યાક્ષર મંત્ર તેનો જપ કરવો. || ૫૬ ||

અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ, તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. || ૫૭ ||

અને પદ્ધી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પદ્ધી ત પ્રસાદી એવું જે અત્ત તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું.
॥ ૫૮ ॥

અને નિર્ગુણ કહેતાં માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ, તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વ છિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કલ્યા છે. ॥ ૫૯ ॥

અને એ જે આત્મનિવેદી ભક્ત, તેમણે તો શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ, તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. ॥ ૬૦ ॥

અને વળી સર્વ જે અમારા સત્તસંગી તેમણે વૃદ્ધાપણા થકી અથવા કોઈ મોટા આપદ્યાળે કરીને અસર્મથપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને, પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. ॥ ૬૧ ॥

અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થ ધર્મવંશના જે આચાર્ય, તેમણે જ આઘું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય, તે જ સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે, પણ સેવવા યોગ્ય નથી. ॥ ૬૨ ॥

અને અમારા જે સર્વ સત્તસંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજ્ઞના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ॥ ૬૩ ॥

અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાંઝિતે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં. ॥ ૬૪ ॥

અને અમારા આશ્રિત જે સર્વ સત્તસંગી તેમણે જે પ્રકારે પૂર્વ કલ્યાણ એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું, અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ, તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ॥ ૬૫ ॥

અને જે મનુષ્ય જેવા ગુણો કરીને યુક્ત હોય, તે મનુષ્યને તેવા કાર્યને વિષ વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. ॥ ૬૬ ॥

અને પોતાના જે સેવક હોય, તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અગ્રવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. || ૬૭ ||

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકળાનુસારે યથાયોગ્ય બોલાવવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. || ૬૮ ||

અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી, એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું, ઈત્યાદિક કિયાએ કરીને એમનું સન્માન કરવું. || ૬૯ ||

અને ગુરુ, દેવ ને રાજા, તેમની સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, તથા વસ્ત્રે કરીને ઢીચણાને બાંધીને ન બેસવું. || ૭૦ ||

અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અગ્ર, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. || ૭૧ ||

અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કણ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. || ૭૨ ||

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે ધર્મ તે જો ધર્મ રહિત હોય, તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. || ૭૩ ||

અને પૂર્વ થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. || ૭૪ ||

અને કોઈની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઈ ઠેકણે પણ પ્રકાશ કરવી જ નહિ, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ધટટું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદિદ્ધિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. || ૭૫ ||

અને અમારા જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. || ૭૬ ||

અને તે વિશેષ નિયમ તે ક્રિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કિર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પા� કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી.
॥ ૭૭ ॥

તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવો; એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો.
॥ ૭૮ ॥

અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. ॥ ૭૯ ॥

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો; તેમ જે, જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. ॥ ૮૦ ॥

અને સર્વ વैષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેના પુત્ર જે શ્રી વિષ્ણુનાથજી, તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. ॥ ૮૧ ॥

અને તે વિષ્ણુનાથજીએ કર્યો જે નિર્ણય, તેને જ અનુસરીને સર્વ વ્રત ને ઉત્સવ કરવા, અને તે વિષ્ણુનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. ॥ ૮૨ ॥

અને સર્વ જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિષે દ્યાવાન થવું.
॥ ૮૩ ॥

અને અમારા જ આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, એ પાંચ દેવ જે તે પૂજયપણે કરીને માનવા. ॥ ૮૪ ॥

અને જો ક્ષારેક ભૂતપ્રતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણક્વયનો જપ કરવો અથવા હનુમાન ના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો.
॥ ૮૫ ॥

અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વ સત્તસંગી તેમણે બીજી સર્વ ક્ષિયાનો તત્કાળ ત્યાગ કરીને, પવિત્ર થઈને, શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જ્યુ કરવો. || ૮૬ ||

અને તે ગ્રહણ મુક્ષાઈ રહ્યા પછી, વસ્તે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્તસંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. || ૮૭ ||

અને અમારા સત્તસંગી એવા જે ચારે વર્ષાના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક, તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. || ૮૮ ||

અને જે બ્રાહ્મણ વર્ષ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ, એ આદિક જે ગુણ, તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ષ હોય તેમણે શુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ, તેમણે યુક્ત થવું. || ૮૯ ||

અને વैશ્ય વર્ષ હોય તેમણે કુષિકર્મ તથા વણજવ્યાપાર તથા વ્યાજવટો, એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે શુદ્ધ વર્ષ હાય તેમણે બ્રાહ્માદિક ત્રણ વર્ષાની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. || ૯૦ ||

અને જે દ્વિજ વર્ષ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ, એ ત્રણ જે તે પોતાના ગૃહસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવાં. || ૯૧ ||

અને ક્યારેક જાણ્યે અથવા અજાણ્યે જો નાનુંમોટું પાપ થઈ જાય, તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. || ૯૨ ||

અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર, તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ, તથા ભધાભારતને વિષે તો શ્રી વિષ્ણુસહસ્રનામ. || ૯૩ ||

તથા શ્રીભગવદ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ, તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવ માહાત્મ્ય || ૯૪ ||

અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાશવલ્કયાજ્ઞાણિની સ્મૃતિ, એ જે આઠ સચ્ચાસ્ત્ર તે અમને હૃદય છે. || ૯૫ ||

અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વ શિષ્ય તેમણે એ આઠ સંખાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સંખાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. || ૮૬ ||

અને તે આઠ સંખાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત, એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્યપ્રક્રિયાની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. || ૮૭ ||

અને વળી એ આઠ સંખાસ્ત્રને વિષે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સુંધ, તે જે શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થ સર્વથી અધિકપણે જાણવા. || ૮૮ ||

અને દશમસુંધ તથા પંચમસુંધ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેતાં દશમસુંધ તે ભક્તિશાસ્ત્ર છે, અને પંચમસુંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે, એમ જાણવું. || ૮૯ ||

અને શ્રીરામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીમાધ્ય તથા શ્રીમદ્ગવદ્ ગીતાનું ભાષ્ય, એ જે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. || ૧૦૦ ||

અને એ સર્વ સંખાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય || ૧૦૧ ||

તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મસહિત જ કરવી, એવી રીતે તે સર્વ સંખાસ્ત્રનું રહસ્ય છે. || ૧૦૨ ||

અને શ્રુતિ ને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદ્ગાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. || ૧૦૩ ||

અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો, અને જીવ, માયા અને ઈશ્વર, તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. || ૧૦૪ ||

અને જીવ છે તે હૃદયને વિષે રદ્ધ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રદ્ધ્યો છે, અને અછેદ, અભેદ, અજર, અમર, ઈત્�ાદિક છે લક્ષ્ણ જેનાં એવો જીવ છે, એમ જાણવો. || ૧૦૫ ||

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, ને અંધકારરૂપ છે, ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે, અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંમમત્વની કરાવનારી છે, એમ માયાને જાણવી. ॥ ૧૦૬ ॥

અને જે ઈશ્વર છે, તે જે તે, જેમ હૃદયને વિષે જીવ રસ્યો છે, તેમ તે જીવને વિષે અંતર્યાખ્યાનિક કરીને રસ્યા છે, ને સ્વતંત્ર છે, ને સર્વ જીવને કર્મફળના આપનારા છે, એમ ઈશ્વરને જાણવા. ॥ ૧૦૭ ॥

અને તે ઈશ્વર તે ક્યા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રીકૃષ્ણા, જે તે આપણા ઈષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ॥ ૧૦૮ ॥

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાવિકળાએ યુક્ત હોય, ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા, અને રૂક્મિણીરૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ॥ ૧૦૯ ॥

અને તે શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે, એમ જાણવું. ॥ ૧૧૦ ॥

અને એ જે રાધાદિક ભક્ત તે જે તે કચારેક તો શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કચારેક તો અતિસ્નેહે કરાને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. ॥ ૧૧૧ ॥

એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ તેમને વિષે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો, અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રપણું ઈત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે, એમ જાણવું. ॥ ૧૧૨ ॥

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન, તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. ॥ ૧૧૩ ॥

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, કયું, તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્ત કરવી ને સત્સંગ કરવો, અને એમ ભક્ત ને સત્સંગ, એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. ॥ ૧૧૪ ॥

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તોપણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. || ૧૧૫ ||

અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, એ જે ત્રણ દેહ, તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને, પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્ત જે તે સર્વ કળને વિષે કરવી. || ૧૧૬ ||

અને શ્રીમદ્ ભાગવતપુરાણનો જે દશમ સંક્ષિપ્ત તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા વર્ષોવર્ષ એક વાર સાંભળવો, અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો. || ૧૧૭ ||

અને એ જે દશમસંક્ષિપ્ત તેનું પુરશ્વરણ જે તે પુણ્યસ્થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું - કરાવવું, તે પુરશ્વરણ કેવું છે, તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. || ૧૧૮ ||

અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજ રીતે ન વર્તવું. || ૧૧૯ ||

અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાનાં, તે જે તે દેશ, કણ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય, એટલાંને અનુસારે કરીને જાણવાં. || ૧૨૦ ||

અને અમારો જે ભત તે વિશિષ્ટાદ્ધત છે એમ જાણવું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. || ૧૨૧ ||

અને આ જે પૂર્વ સર્વ ધર્મ કલ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ, બાઈ, ભાઈ, સર્વ સત્સંગી તેમના સામાન્ય ધર્મ કલ્યા છે, કહેતાં સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે, અને એ સર્વના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્ પૃથક્પણે કરીને કહીએ છીએ. || ૧૨૨ ||

હવે પ્રથમ ધર્મવંશો જે આચાર્ય અને તેમની પત્નીઓ તમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ: અમારા મોટા ભાઈ અને નાના ભાઈ, તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજ સ્ત્રીઓ, તેમને મંત્ર ઉપદેશ કર્યારેય ન કરવો. || ૧૨૩ ||

અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઈ જીવને વિષે ફૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. || ૧૨૪ ||

અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું અને કોઈ આપત્કાળ આવી પડે તો બિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. || ૧૨૫ ||

અને પોતાના જે શિષ્ય, તેમણે ધર્મ નિમિત્ત પોતાને આપ્યું જે અજ તે વેચવું નહિ, અને તે અજ જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું, અને એવી રીતે જે જૂનાનું નવું કરવું, તે વેચ્યું ન કહેવાય. || ૧૨૬ ||

અને ભાદરવા સુદ્ધિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદ્િ ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. || ૧૨૭ ||

અને અમારે આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. || ૧૨૮ ||

અને પોતાના આશ્રિત જે સર્વ સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સયાસ્ત્રનો અત્યાસ આદર થકી કરવો. || ૧૨૯ ||

અને મોટાં જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણના સ્વરૂપ, તેમની જે સેવા તે યથાવિષિએ કરીને કરવી. || ૧૩૦ ||

અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઈ અજાર્થી મનુષ્ય, તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અજના દાને કરીને આદર થકી સંભાવના કરવી. || ૧૩૧ ||

અને વિદ્યાર્થી ભજાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્ધાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સહ્દિયાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુષ્ય થાય છે. || ૧૩૨ ||

અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આશા એ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષને ન કરવો. || ૧૩૩ ||

અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું.
(એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કલ્યા.) ॥ ૧૩૪ ॥

હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ: અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ,
તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. ॥ ૧૩૫ ॥

અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને
દીકરી, તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન
કોઈને ન કરવું. ॥ ૧૩૬ ॥

અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ, તે કોઈ
પ્રકારે પણ ન જ કરવો. ॥ ૧૩૭ ॥

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ધેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે
અન્નાદિકે કરીને પૂજવો, અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાવાદિક જે પિતૃકર્મ, તે જે તે
પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. ॥ ૧૩૮ ॥

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ
મનુષ્ય, તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ॥ ૧૩૯ ॥

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને
કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણાનો ઉચ્છેદ ન કરવો. ॥ ૧૪૦ ॥

અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ધરમાં
વરો હોય તેટલાં અન્ન-દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ધરમાં પણ હોય એવા જે ગૃહસ્થ
તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો. ॥ ૧૪૧ ॥

અને ગાય, બળદ, ભેશ, ધોડા આદિક જે પણ, તેમની તૃષ્ણ-જળાદિકે કરીને પોતા વતે જો
સંભાવના થાય તો તે પણને રાખવાં, અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ॥ ૧૪૨ ॥

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને ભિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનનાં
લેણાદેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. ॥ ૧૪૩ ॥

અને પોતાનું અથવા બીજાનું જ વિવાહ સંબંધી કાર્ય, તેને વિષે આપવા યોગ્ય જે ધન, તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. || ૧૪૪ ||

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વ ગૃહસ્થોએ મનમાં જાણવું. || ૧૪૫ ||

અને પોતાના વ્યવહારકાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય, તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂહ અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. || ૧૪૬ ||

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્ઘામ, તે થકી પાખ્ય જે ધનધાન્યાદિક, તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય, તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. || ૧૪૭ ||

અને એકાદશી આદિક જે ક્રત તેમનું જે ઉદ્ઘાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણો યથાશાસ્ત્ર કરવું, તે ઉદ્ઘાપન કેવું છે, તો મનવાંછિત ફળને આપનારું છે. || ૧૪૮ ||

અને શ્રાવણ માસને વિષે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. || ૧૪૯ ||

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ, તે માણી લાવવાં નહિ. || ૧૫૦ ||

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ, એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગ ને વિષે પારકું અનુ ખાવું નહિ, તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક, તેમને વિષે પણ પારકું અનુ ખાવું નહિ, કેમ જે તે પારકું અનુ તો પોતાના પુષ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. || ૧૫૧ ||

અને પોતાના કામકાજ કરવા તેજ્યા જે મજૂર, તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કલ્યાં હોય તે પ્રમાણો જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું, અને પોતા પાસે કોઈ કરજ માગતો હોયઅ ને તે કરજ દઈ ચૂક્યા હોઈએ, તે વાતને છાની ન રાખવી તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. || ૧૫૨ ||

અને જે ઠેકાણ પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ-ભૂડો કણ અથવા શત્રુ અથવા રાજી, તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય ॥ ૧૫૩ ॥

અને તે જે પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય, તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કણ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે સુખેથી રહેવું. ॥ ૧૫૪ ॥

અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વારદી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવાં. ॥ ૧૫૫ ॥

અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવાં. ॥ ૧૫૬ ॥

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજી તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠ પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ॥ ૧૫૭ ॥

અને તે રાજી તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ, તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં, અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક, તથા વ્યવહારના જાણનારા જ સભાસદ, તથા દંડવા યોગ્ય જે માણસ, તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ - એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં. ॥ ૧૫૮ ॥

હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ, તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પદ સેવવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. ॥ ૧૫૯ ॥

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો. ॥ ૧૬૦ ॥

અને પતિત્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓફ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઈ જોવા ન જવું અને નિર્લજ્જજ એવી જે સ્ત્રીઓ તથા સૈરિણી, કામિની અને પુંશ્લલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ॥ ૧૬૧ ॥

અને સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સત આભૂષણ ન ધારવાં ને રૂડાં વસ્ત્ર ન પહેરવાં, ને પારકે ધેર બેસવા ન જવું, અને હાસ્યવિનોદાદિકનો ત્યાગ કરવો. || ૧૬૨ ||

હવે વિધવા સ્ત્રીઓના વિશે ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતાપુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. || ૧૬૩ ||

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ, તે મની સાથે ક્યારેય પણ બોલવું નહિ. || ૧૬૪ ||

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી, તેમ દોષ નથી, અને કોઈ અવશ્યનું કામકાજ પડે, તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય, તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. || ૧૬૫ ||

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પાતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી, અને વ્રત ઉપવાસે કરીને વારંવાર દેહનું દમન કરવું. || ૧૬૬ ||

અને વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય, તો તે ધન જે તે ધર્મકર્યને વિષે પણ ન આપવું અને જા તેથી અધિક હોય તો આપવું. || ૧૬૭ ||

અને વિધવા સ્ત્રીઓ તેમણે એક વાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂતું અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષી આદિક જીવગ્રાહીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ. || ૧૬૮ ||

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો, તથા સંન્યાસણી તથા વૈરાગ્યાણી તેના જેવો વષ ન ધારવો, અને પોતાનો દેશ, કુળ અને આચાર, તેના વિરુદ્ધ એવો જે વેષ, તે પણ ક્યારેય ન ધારવો. || ૧૬૯ ||

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો ને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. || ૧૭૦ ||

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. || ૧૭૧ ||

અને હોળીની રમત ન કરવી અને આભૂષણાદિકનું ધારણ ન કરવ, અને સુવર્ણાદિક ધાતુના તારે
યુક્ત એવાં જે જીણાં વસ્ત્ર, તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. || ૧૭૨ ||

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહિ, અને પોતાનું
જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. || ૧૭૩ ||

અને વળી રજસ્વલા એવી જ સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને
તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસ નાહીને અડવું. (એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે
પુરુષ અને સ્ત્રીઓ, તેમના જે આ વિશેષ ધર્મ કલ્યા, તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની
પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે.) || ૧૭૪ ||

હવે નૈષિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીઅઃ અમારે આશ્રિત એવા જે નૈષિક બ્રહ્મચારી
તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ, અને જાણીને તે સ્ત્રીઓ
સન્મુખ જોવું નહિ. || ૧૭૫ ||

અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો
પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક કિયા કરવા ન જવું. || ૧૭૬ ||

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા, યિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ
ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ. || ૧૭૭ ||

અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું
જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસક્ત એવાં જે પશુ-પક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને
જોવાનું નહિ. || ૧૭૮ ||

અને સ્ત્રીના વેષને ધરી રદ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામું જોવું નહિ અને
તે સાથે બોલવું નહિ અને સ્ત્રીને ઉદ્ધા કરીને ભગવાનની કથા, વાર્તા, કિર્તન પણ ન કરવાં.
|| ૧૭૯ ||

અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યપ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના
ગુરુનું પણ ન માનવું અને સદકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું અને માને રહિત
રહેવું. || ૧૮૦ ||

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર
કરીને પણ તુરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ. || ૧૮૧ ||

અને જે ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય તેવો આપત્કણ આવી પડે, ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. || ૧૮૨ ||

અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો, અને રસના ઈન્દ્રિયને જીતવી. || ૧૮૩ ||

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર લિક્ષા કરવા જવું નહિ, ને જ્યાં પુરુષ પિરસનારો હોય ત્યાં જવું. || ૧૮૪ ||

અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રેણ પુરુષનો સંગ જે તે સર્વકણે વર્જવો. || ૧૮૫ ||

અને જીતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું, અને દુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જીતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. || ૧૮૬ ||

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વैશ્વદેવ - એટલાં વાનાં કર્યા વગર ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કલ્યા.)
|| ૧૮૭ ||

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીઅઃ અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષિક બ્રહ્મચારી ની પેઠે સ્ત્રીઓનાં દર્શન-ભાષ્ણાદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રેણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્ષોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. || ૧૮૮ ||

અને સર્વ જે ઈન્દ્રિયો તે જીતવી અને રસના ઈન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. || ૧૮૯ ||

અને કોઈની પણ થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જયગા બંધિની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.
|| ૧૯૦ ||

અને એ સાધુ તેમણે આપત્કણ પડ્યા વિના રાત્રિને વિષે સંઘસોભત વિનાનું ચાલવું નહિ, તથા આપત્કણ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. || ૧૯૧ ||

અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા યિત્ર-વિયિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલદુશાલા હોય, ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્ત્ર પોતે પહેરવું-ઓફું નહિ. ॥ ૧૮૮ ॥

અને બિક્ષા તથા સભાપ્રસંગ - એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ, તે વિના વર્થ કણ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કણ નિર્ગમવો. ॥ ૧૮૯ ॥

અને જે ગૃહસ્થના ઘરને વિષે રંધેલ અત્મનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય અમ ન હોય ॥ ૧૯૦ ॥

તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું, અને એ કલ્યાણ તેવું ન હોય તો કાચું અત્ર માંગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવ, ॥ ૧૯૧ ॥

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણથક જેમ વર્તતા હતા, તેમ જ પરમહંસ એવા જે અમારા સાધુ, તેમણે વર્તવું. ॥ ૧૯૨ ॥

અને નૈષિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઈત્યાદિકનું જે ભક્ષણ, તે જતને કરીને વર્જવું. ॥ ૧૯૩ ॥

અને તે નૈષિક બ્રહ્મચારી ને સાધુ, તેમણે ગર્ભધાન આદિક જે સંસ્કાર, તમને વિષે જમવું નહિ, તથા દ્વાદ્શાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ॥ ૧૯૪ ॥

અને રાગાદિક આપત્કણ પડ્યા વિના દિવસે સૂતું નહિ, અને ગ્રામ્યવાર્તા કરવી નહિ, ને જાણીને સાંભળવી નહિ. ॥ ૧૯૫ ॥

અને તે નૈષિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કણ પડ્યા વિના ખાટલા ઉપર સૂતું નહિ અન સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ॥ ૨૦૦ ॥

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટ જન હોય, ને તે પોતાને ગાળ હે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન ઢેવી ને મારવો નહિ, અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં સિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ॥ ૨૦૧ ॥

અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાદ્યાપણું ન કરવું ને કોઈનાં ચારચક્કુ ન થવું અને હેઠને વિષે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિષે ભમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કલ્યાં.) ॥ ૨૦૨ ॥

અને અમારે આશ્રિત અવા જે સત્સંગી બાઈ, બાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંકેપે કરીને આવી રીતે અમે લખ્યા છે, અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. ॥ ૨૦૩ ॥

અને સર્વે જે સત્સાસ્ત્ર તેનો જે સાર, તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ઘારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે, તે કેવી છે, તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. ॥ ૨૦૪ ॥

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણો તો ક્યારેય ન વર્તવું. ॥ ૨૦૫ ॥

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ, તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ॥ ૨૦૬ ॥

અને જે બાઈ-બાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે, તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે, એમ અમારા સંપ્રદાયવાળાં સ્ત્રી-પુરુષ તમણે જાણવું. ॥ ૨૦૭ ॥

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતાં આવડતું ન હોય, તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. ॥ ૨૦૮ ॥

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી, તે અમારું સ્વરૂપ છે, તે રીતે પરમ આદર થકી માનવી. ॥ ૨૦૯ ॥

અને આ જે અમારી શિક્ષાપત્રી, તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી, અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. ॥ ૨૧૦ ॥

સંવત ૧૮૮૮ (અઢારસો બ્યારી)ના મહા સુદ્ધિ પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે, તે પરમ કલ્યાણકારી છે. ॥ ૨૧૧ ॥

અને પોતાના આશ્રિત જે ભક્તજન, તેમની જે સમગ્ર પીડા, તેના નાશ કરનારા એવા, અને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા, અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા - એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ॥ ૨૧૨ ॥
॥ ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિર્ષ નિત્યાનંદ મુનિ વિભિતા શિક્ષાપત્રી સમાપ્ત ।